

ગુજરાતી ભાષાનો 'રોકડીયો' હીસાબ

-લલીત લાલ

આપણા ગુજરૂઓ 'મની માઈનેડ' છે, છે, ને સાડી સતરવાર છે. આપણને મની માઈનેડ કહે છે ત્યારે અમને તો જરાયે ખોટું નથી લાગતું. કારણ શું? દુનીયાની બહુ ઓછી પ્રજા પૈસાને પીછાળી જાણો છે. પણ બોસ, તમે જુઓ આપણી ગુજરાતી ભાષામાં આ જ કારણસર કેટલા બધા વેપારી શબ્દો ઘુસી ગયા છે!

અમારા અમદાવાદમાં તમને વારંવાર સાંભળવા મળે 'એમાં મારે કેટલા ટકા?'

તું નવી કાર લાવે એમાં મારે કેટલા ટકા? પાડોશીનો દીકરો પહેલા નંબરે પાસ થાય એમાં મારે કેટલા ટકા? અલ્યા, સચીન સેન્ચ્યુરી મારે કે જીરોમાં જાય... મારે કેટલા ટકા? અમદાવાદી તો એના ભાઈબંધ જોડે પણ વેપારી ભાષામાં બોલે, 'જાને બે, તું મારી જોડે પીચ્યર જોવા ના આવે એમાં મારે કેટલા ટકા?'

હવે ભાઈબંધ એની જોડે પીચ્યર જોવા આવે કે ના આવે, એમાં ભાઈને કેટલા ટકા કમીશન મળવાનું છે? પણ એવો સવાલ જ ના કરાય.

આવું જ 'ડિસ્કાઉન્ટ' નું છે. હંમેશાં મોટી મોટી છોલતા હોય એવા લોકો માટે કહેવાય કે, 'એની વાતમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ ગણીને જ ચાલવાનું!' મતલબ કે વાતમાં પચાસ ટકા જ સાચું.

ભાવનાત્મક 'ભાવ'

જરા વીચારો તો ખબર પહોંચે કે ઓહોહો, કેટલા બધા ધંધાદારી શબ્દો ઘરેઘરે વપરાતા થઈ ગયા છે!

કોઈ બહુ ઘમંડી હોય તો કહેવાય કે 'બહુ ભાવ ખાય છે!' છતાં એને મનાવવા હોય, આપણું કામ કઢાવવું હોય તો 'ભાવ આપવો પડે!'

જરા લખી રાખજો સાહેબ, 'ભાવ ખાનારા' અને 'ભાવ માગનારા' જુદા હોય છે!

સામાન્ય લોકો પણ સીદ્ધાંત બનાવતા હોય છે કે ફલતું લોકો જોડે બેસીને આપણો 'ભાવ નહીં' બગાડવાનો !'

ધંધાનો ટાઈમ ખરાબ થાય

'કવીરાજા મત કવીતા લીખો, ધંધેકી કુછ બાત કરો, કુછ પૈસે જોડો...' એમ લખનારા કવી પ્રદીપજી પોતે ગુજરાતી નહીં હોય તો કમસેકમ એ જ્યાંનો લોટ ખાતા હોશે એ ધંટીવાળો ગુજરાતી હોશે. વેપારી ભાષાની કેટલી બધી કહેવતો આપણી ગુજરાતી ભાષામાં 'મફન્ટ'ના ભાવે ઘુસી ગઈ છે? 'રાયના ભાવ રાતે ગયા', 'તેલ જુઓ; તેલની ધાર જુઓ', 'બોલે તેના બોર વેચાય', 'લક્ષ્મી ચાંદ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ના જવાય', 'બાંધી મુઢી લાખની', 'લાખ બેગા સવા લાખ', 'બક્ષીસ લાખની; હીસાબ કોડીનો' અને 'સસ્તું ભાડું ને સીદ્ધપુરની જત્રા !'

કોઈ કામ સહેલાઈથી પતે તો કહેવાય કે, 'સસ્તામાં પત્યું!' અને કોઈ સસ્તા માણસની ઝીરકી લેવાની હોય તો કહેશે 'તમે તો જૈશા' બાબુ મોંદા માણસ થઈ ગયા ને કાંઈ?'

શેઠીયા જરા સમજો ને!

માત્ર વેપારીઓ જ શેઠીયા હોય એવું નથી. આજકાલ તો અમદાવાદમાં બધાને 'આવો ને શેઠીયા !' એમ કહીને બોલાવવાનો રીવાજ છે.

ભાઈ મહીને માંડ બે હજાર રૂપૈઠી કમાતા હોય અને એ જ કારણસર બીચારા સાવ નવરાધુપ બેઠા હોય તો એમને કહેવાય કે, 'ધાર, તમે તો શેઠ માણસ ! તમને કંઈ તકલીફ અપાય?' અમારા એક ભાઈબંધ પેટ ભરીને જમ્યા પછી રોજ બોલે, 'આપણો જમી લીધું, એટલે પછી કસ્તુરભાઈ લાલભાઈ !'

પ્રતીષ્ઠીત વેપારીને શાહુકાર કહેવાય એ સાચું; પણ વધારે પહતી સફરી ઠોકનારને અમદાવાદીઓ તરત ચોપડાવે ‘અબે બહુ શાહુકારી ના માર !’ આ તો ઠીક છે; પણ અમદાવાદની અમુક પોળોમાં આજે પણ રાત પહે તમારા ઘરમાં વધેલું ખાવાનું માગવા જે ગરીબો આવે છે તે આ રીતે બુમ પાડે છે : ‘એ... શાહુકારી આલજો...બા !’

-આપણે જે એંઠવાડ ભીજારીને આપી દઈએ એને ‘શાહુકારી’ કહેવાય એ અમદાવાદમાં જ બને !

અને બોસ, આ ‘બોસ’ શબ્દ બોલચાલમાં ક્યાંથી આવ્યો ? અમદાવાદમાંથી સ્તો !
પોષાય, પરવહે અને ખોટ જ્યા ?

‘સવારના છ વાગો ઉઠીને દુધની કોથળી લેવા જવાનું આપણાને ના પોષાય !’ અલ્યા ભાઈ, સવા આઈ રૂપીયાની દુધની કોથળીમાં તમે એવા તે શા વેપાર કરી નાખો છો કે પોષાવા-પરવહવાની વાતો કરો છો ? પણ એવું...

‘બધ્યું કાન્તામાસીના ઓટલે બેઠાં બેઠાં વાતો કર્યા કરવાનું આપણાને ના પરવહે !’ જાણો કાન્તમાસી ‘ઓટલા-ટેક્સ’ ના લેતાં હોય ! એવું જ ‘લેણા-દેણી’નું. આપણે ‘લેવા-દેવા’ વીના જગતો ના કરીએ. પારકી પંચાત કરીને ‘શું લેવાનું ?’ ચંદુલાલ અમારા દુરના સગા ખરા; પણ અમારે ખાસ ‘લેવા-દેવા’ નહીં. ગુજરાતી ભાષામાં ફીલોસોઝીની ઉચ્ચાઈ પર છેક ટોપ પર પહોંચી ગયેલો શબ્દ પણ વેપારી ભાષાની આલમનો છે... ‘લેણાદેણી !’ હશે, વેપારીઓની પણ અધ્યાત્મ સાથે કંઈ ‘લેણાદેણી’ જરૂર હશે ! બાકી વેપારીઓ આવા ‘ખોટના ધંધા’ કરતા હશે ?

બહુનો પણ વહેવારમાં બોલશે, ‘અમે તમારે ત્યાં જમવા આવીએ, ને તમે અમારે ત્યાં ચા પીવાય નો આવો એવા ખોટના ધંધા નો હાલે, હોં !’ બોલો, મહેમાનગતીમાંય ‘નફો-ખોટ’ જોવાય છે કે નહીં !

મારે હીસાબે તો...

પાનના ગાલ્વે ઉભાં ઉભાં પાનની પીચકારી મારતાં તમને ગંભીર મુદ્રામાં વર્લ્ડ-પોલીટીક્સ સમજવતાં શ્રીમાન ધનસુખરાય કહેશે, ‘મારા હીસાબે તો... અમેરીકા હજી તો ઈરાન પર હુમલો નહીં કરે !’ અલ્યા ધનસુખ, આમાં તે અહીં ધના સુધારની પોળ આગળ ઉભાં ઉભાં બુશ, અમેરીકા અને ઈરાનના કયા ‘હીસાબ’ ગણી કાઢ્યા ?

પણ તમે ગમે તેટલી સાચી સલાહ આપો, એમને મન તો આપણે ‘કંઈ હીસાબમાં જ નહીં ને?’ બે જણા વચ્ચે દસ વરસે માંડ એકાદ વાર મળવાના સંબંધો હોય તોય કહેવાય શું ? ‘અમારો તો બજુનો હીસાબ છે !’

સંબંધમાં ‘ભુલચુક લેવી દેવી’ થાય, ક્યારેક ‘લેવાનું ગાજર’; છતાં રહેવાનું હાજર’ એવું થાય, ક્યારેક એમ થાય કે ‘ત્યાં શું દલ્લો દાટ્યો છે ?’ ક્યારેક આટાટલી મમતા રાખ્યા છતાંય એવી ફીલીંગ થાય કે આમાં ‘શું કમાયા?’ ઘણીવાર સામેનો માણસ સાવ ‘ઉધાર’ હોય, ઘણીવાર આખી ‘પાર્ટી બોગસ’ હોય, આપણાને ખબર હોય કે આમાં ‘કંઈ લેવાનું’ નથી છતાં... છતાં ‘સરવાળે’ એમ થાય કે જવા દો ને, બોલીને કયાં બગાડવું ? ‘સંઘર્યો સાપ પણ કામ આવે !’

ગણા, ગુજરાતી ગણા...

બીચારો ગુજરાતી આખી જીંદગી ગણિતો જ ગણાતો હોય છે. ઘણીવાર ‘ગણતરી સાચી પહે’ તો ક્યારે ‘ગણતરીમાં થાપ ખાઈ જવાય.’ છેવટે મુળ વાત એટલી કે સમાજમાં આપણી ‘ગણના’ થવી જોઈએ. બાકી જો આપણી ‘ગણતરી’ જ ના હોય તો, ગામમાં આપણી ‘કેરીટ’ જ ના હોય તો, ‘ગાંઠનું ગોપીચંદન’ કર્યા કરવામાં કોઈ ‘માલ’ નથી.

વેપારી ભાષાના જેટલા શબ્દો ગુજરાતી ભાષામાં ભજ્યા છે એટલા કદાચ ભારતની તો શું, દુનીયાની કોઈ ભાષામાં નહીં ભજ્યા હોય. ‘આપજો રૂપીયો જ ખોટો’ એટલે આપજો જ માણસ નબળો છે. એ ‘ખોટા રૂપીયા’ની જેમ પાછો આવશે; કારણ કે એ બાધો છે, બબુચક છે. આવા માણસ માટે કહેવાય છે કે ‘જરા પાવલી ઓછી છે.’ બજુ વીધાસપાત્ર અને કાબેલ માણસ હોય તો કહેવાય કે ‘લાખ રૂપીયાનું માણસ !’ પણ જેના પર ભરોસો ના મુકાય એના માટે તો સ્ટાન્ડર્ડ રૂઢીપ્રયોગ શો છે ? ‘જવા દો ને યાર, એ તો લાખના બાર હજાર કરે એવો છે !’

સાવ છટકેલી કમાનવાળા ભાઈને ‘નુકસાની આઈટેમ’ કહેવાય. નમુનેદાર(બન્ને રીતે) માણસ માટે કહેવાય ‘આઈટેમ છે, હોં બોસ !’ અમુક વીચીત્ર આઈટેમને ‘લગડી’ આઈટેમ પણ કહેવાય. વેપારી ભાષાના આ શબ્દો માણસો પર કેટલા સરસ રીતે ફીટ થાય છે ? ‘નંગ છે હોં ?’, ‘જણસ છે, જરા સાચવજો !’ ‘એ તો બહારથી સારી આઈટેમ લાગો; બાકી અંદર બજુ ખરચો છે !’ બજુ ચાલાક માણસ માટે કહેવાય કે, ‘એકદમ પેટીપેક માણસ છે.’

સામાન્ય વાતચીતમાં સાચી વાતને ‘રોકડા રૂપીયા’ જેવી વાત કહેવાય છે. બાકી ટાઈમ પાસ કરવા માટે ‘પરચુરણ વાતો’ ક્યાં સુધી કર્યા કરવાની ? હવે તો બાળકોને પણ ‘ચીલ્વર’ કહે છે ! વારંવાર દાંત બતાડીને હસ્યા કરતી છોકરી માટે કહેવાય છે કે, ‘એનું ચીલ્વર બજુ ખખે છે !’

છોકરી સુંદર હોય ત્યાં સુધી તો બરાબર; પણ અક્કલની ઓછી હોય તો ‘બોલે એટલે પૈસા પડી ગયા સમજો !’

કીકેટર પહેલો રન લે તો કહેશે ‘ખાતું ખોલાયું !’ કોઈને બે ધોલ મારી હોય તો કહેવાય કે ‘બે રસીદ કરી દીધી !’ અચા, વહોરવા જવું એટલે શું ? ખરીદી કરવા જવું ને ? પરંતુ ‘દુશ્મની વહોરી લીધી’ એવું તો ગુજરાતીમાં જ કહેવાતું હશે..

ચાલો, આ લેખ વાંચીને તમને ‘પૈસા વસુલ’ થયા એવું ના લાગતું હોય તો ક્યારેક ઘરે આવી જજો; ‘વેરની વસુલાત’ કરવા.

-લલીત લાડ

સંપર્ક: ‘ગાયત્રી કૃપા’-વીભાવરી સોસાયટી-બે, જીવરાજ પાર્ક, અમદાવાદ-380 015

ફોન: (079) 2682 6526 **મોબાઇલ:** 98980 67030

(‘ગુજરાત સમાચાર’માંની લેખકની કટાર ‘હવામાં ગોળીબાર’માંથી સંકલીત થઈ, ‘નયામાર્ગ’ પાક્ષીકમાં દર બે મહીને પ્રગટ થતી, શ્રી. મનીષી જાની સંપાદિતપુરી ‘ભાષાવીચાર’માંથી અહીં સાભાર...)

‘સન્દેશ-મહેશીલ’ -- વર્ષ: બે -- અંક: 96 -- એપ્રીલ 8, 2007

માટે ‘ઉંગાજોણી’ અને ‘વીજયા ફેન્ટ’માં અક્ષરાંકન: uttamgajjar@hotmail.com



લેખક પરીચય

સને ૧૯૮૫માં જન્મેલા અને દક્ષીણ ગુજરાતના ચીખલી તાલુકાના વતની શ્રી. લલીત લાડ ઘણા સમયથી ‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં ‘મનુષ શેખચલ્લી’ના ઉપનામે ‘હવામાં ગોળીબાર’નામની મર્જેદાર અને ચટપટી કોલમ દ્વારા હાસ્ય પીરસે છે. સ્વાભાવીક રીતે જ આ કટાર ઘણી લોકપ્રીય બની છે. ‘વીભાવરી વર્મા’ના ઉપનામે તેઓ લઘુનવલ અને દુંકી વાતાંઓ પણ સરસ લખે છે.

લલીતભાઈ મુજે ચીત્રકાર. એન.આઈ.ડી.માંથી

ગ્રાફિક ડિઝાઇનની તાલીમ મેળવી વીજાપનના વ્યવસાયમાં તેમણે પગલાં માંજ્યાં. પછી કાર્ટુનો, રેખાંકનો અને પુસ્તકોનાં મુખ્યપૃષ્ઠ તૈયાર કરતાં કરતાં સાહીત્ય સર્જન તરફ છણ્યા. સાહીત્ય સર્જનનો પ્રારંભ કર્યો નાટકોથી અને રસભરી ટીવી સીરીયલોના લેખનથી. શીષમાન્ય ગુજરાતી ભાષા કરતાં બોલાતી ગુજરાતી લોકબોલીના કુશળ વીનીયોગ દ્વારા હાસ્ય છલકાવવાની તેમની શૈલી વીશીષ અને નોંધપાત્ર છે અને તેથી જ તેઓ આવડી લોકપ્રીયતાને વરેલા છે.

‘હુરતી’ બોલીમાં લખાયેલા એમના હાસ્ય લેખો તો જલસો જ કરાવે છે!

—મનીષી જાની—manishijani@hotmail.com (અમદાવાદ) અને બળવંત પટેલ (ગાંધીનગર)

માત્ર બાર માસના ગાળામાં **2,55,000** જેટલા ભાષાપ્રેમીઓએ અત્યાર સુધીમાં <http://www.gujaratilexicon.com> લેક્સિકોનની મુલાકાત લીધી. આપને પણ લેક્સિકોનની આ નવી **interface**ની મુલાકાત લેવાનું નીમંત્રણ છે.

આપ સૌના સહયોગ થકી **સન્ડ ઈ-મહેફીલના** **5000** જેટલા વાચકો થયા અને રોજેરોજ નવાં નામો ઉમેરાતાં જાય છે એ પુરવાર કરે છે કે, દેશવીદેશમાં ગુજરાતી વાચનના રસીયા બહુ મોટી સંખ્યામાં છે જ...

સૌનો આભાર..**સન્ડ ઈ-મહેફીલની** અત્યાર સુધીની જુની સઘળી પીડીએફ ફાઈલો અમારી

<http://sundaymahefil.googlepages.com/> વેબસાઈટ પરથી તથા

<http://gujaratilexicon.com/index.php?action=downloadSeM>

પરથી પણ સરળતાથી ડાઉનલોડ થઈ શકશે. આ જ વેબ સાઈટ પરથી લેક્સિકોન અને શ્રી વીપુલ કલ્યાણી તરફથી લંડનથી પ્રકાશિત થતા ‘ઓપીનીયન’ની અને શ્રી. પ્રવીણ વાધાણી (મેલ્બોર્ન-ઓસ્ટ્રેલીયા) તરફથી પ્રકાશિત થતા ‘માતૃભાષા’ માસિકોની મુલાકાતે પણ જઈ શકશે..

Kindly send your suggestions to

Ratilal Chandaria, e-mail:rpchandaria@comcraft.com

◆◆◆ મધુરેણ સમાપયેત ◆◆◆

પણ ચાર-ચાર કીરણાં હોય એટલે લોચા જ થાપને? પહેલાં હુસ્વ ઈવાળા કીરણો દીર્ઘ ઈવાળી કીરણાનો કંપાસ ઝૂંટવી લીધો કે પહેલાં દીર્ઘ ઈવાળા કીરણની ફુટપદી હુસ્વ ઈવાળી કીરણો તોડી નાથ્યી એ જ ખબર નથી પડતી! મારે સજી કોને કરવી?



ખોટી જોડણીવાનું પાટીયું ચીતરાઈ ગયું? રહેવા હે!
ભવીષ્યમાં એના ઘરાકો આવવાના જ છે!



માફ કરજો, પ્રમુખશ્રી ભાષણ નહી કરે. કારણકે તેઓ
તેમનું દાંતનું ચોકું ધરે ભુલી ગયા હોવાથી સાચા
ઉચ્ચારો કરવા અશક્તીમાન છે !



‘ગુજરાતી ભાષાપરીક્ષા’ પ્રકાશીત ‘જોડણીવીચાર’ સામયિક માટે શ્રી. લલીત લાડે કેટલાંક કાર્ટુન
કરેલાં. તેમાંનાં કેટલાંક નમુનાં..ભાઈ કીરણ ત્રીવેદી : info@manavmedia.com ના
સૌજન્યથી સાભાર....

‘સંજે ઈ-મહેઝીલ’ -- વર્ષ:૬ -- અંક: 96 -- એપ્રિલ 8, 2007
માટે ‘ઉત્તાજોડણી’ અને ‘વીજ્યા શીન્ટ’માં અક્ષરાંકન: uttamgajjar@hotmail.com